

સંરેરાશ માસિક બેલેન્સ (AMB)	
સંરેરાશ માસિક બેલેન્સ	૧૦,૦૦૦/- મેટ્રે, શહેરી શાખાઓમાં અર્ધ-શહેરી શાખાઓમાં ૨,૫૦૦/- ગ્રામીણ શાખાઓમાં
AMB બિન-જાળવણી શુલ્ક	શૂન્ય
ફેનિલી એકાઉન્ટ્સ અથવા બિઝનેસ એકાઉન્ટ્સ સાથે સુવિધા	
ક્રેડિટ એકાઉન્ટ સુવિધા	સમાન અથવા ઉચ્ચ મૂલ્યના ક્રેડિટ એકાઉન્ટમાં સુપર ક્રી શકાય છે
સેવિંગ્સ એકાઉન્ટ સુવિધા	ઉચ્ચ મૂલ્યના સેવિંગ્સ એકાઉન્ટમાં સુપર ક્રી શકાય છે
ચેક બુક (૨૫ લીફ્ટની PAP ચેક બુક) મર્યાદા	દર ત્રણ મહિને ૧ ચેક બુક મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ લીફ્ટ ૨ રૂપિયા
ઉઘરાણી	
સ્થાનિક ચેક ક્રિવવર્ટિંગ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	રૂ. ૫૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૨૫, રૂ. ૫૦૦૦ થી વધુ અને
બેંક સિવાયના સ્થળોએ અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	રૂ. ૧૦,૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૫૦/-, રૂ. ૧૦,૦૦૦ થી વધુ અને
RTGS ઇનવર્ડ/NEFT ઇનવર્ડ/IMPS ઇનવર્ડ	રૂ. ૧૦૦૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૧૦૦/-, રૂ. ૧૦૦૦૦૦ થી વધુનું શુલ્ક રૂ. ૧૫૦/-
ફોરેન ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુકવણી	
શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	દર મહિને ૩ લીફ્ટ સુધી મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ લીફ્ટ રૂ. ૫૦
શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	પ્રતિ લીફ્ટ રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખામાં RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઇન)	NEFT: રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨,૨૫, રૂ. ૧૦૦૦૧ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫, RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (દિવસ દીઠ મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦/-)	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ. ૨૫/-, રૂ. ૫૦૦૦૦૦ - રૂ. ૧ લાખ: રૂ. ૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ. ૭.૫/-
રોકડ શુલ્ક	
હોમ બ્રાન્ચે રોકડ જમાની મર્યાદા	પ્રતિ મહિને રૂ. ૧,૦૦,૦૦૦ સુધી મફત.
નોન-હોમ બ્રાન્ચે (એટીએમ સહિત) રોકડની જમા મર્યાદા	શૂન્ય
હોમ નોન-હોમ બ્રાન્ચે (એટીએમ અને શાખા સહિત) મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	રૂ. ૫ પ્રતિ ૧૦૦૦
રહેઠણ સ્થાને રોકડ ઉપાડ	મફત
બિન-રહેઠણ સ્થાને રોકડ ઉપાડ	રૂ. ૨ પ્રતિ ૧૦૦૦
ઇન્સ્ટિટ્યુટ બેંકના તમામ એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહીત)	મફત અમર્યાદિત
મેટ્રે સ્થાને અન્ય બેંકના એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહીત)	૩ વ્યવહારો
નોન-મેટ્રે સ્થાને અન્ય બેંક એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહીત)	૫ વ્યવહારો
મુફત મર્યાદાથી વધુના નાણાકીય વ્યવહારો પર શુલ્ક*	રૂ. ૨૩ પ્રતિ વ્યવહાર
મુફત મર્યાદાથી વધુના બિન-નાણાકીય વ્યવહારો પર શુલ્ક	રૂ. ૧૨ પ્રતિ વ્યવહાર
નોન-ઇન્સ્ટિટ્યુટ એટીએમનો ઉપયોગ - અમૂરતા લંબેશને કારણે રોકડ ઉપાડ નકારવું	રૂ. ૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોકડ ઉપાડ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૧૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૨૫/- પ્રતિ વ્યવહાર
અન્ય શુલ્ક	
રૂપે / વિઝા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીજાણ મહેળા શુલ્ક)	રૂ. ૧૯૯
વિઝા નોટ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીજાણ મહેળા શુલ્ક)	રૂ. ૧૯૯
રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીજાણ મહેળા શુલ્ક)	રૂ. ૨૫૦
વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીજાણ મહેળા શુલ્ક)	રૂ. ૨૫૦
ELITE / વિઝા સિમેયર ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીજાણ મહેળા શુલ્ક)	રૂ. ૬૦૦
કાર્ડ વડે વ્યવહારની વિનિયમી પુનઃપ્રાપ્તિના શુલ્ક (ખોટા ટાપાઓ માટે)	રૂ. ૨૫૦/- પ્રતિ વિનિયમ
સ્લોપ પેમેન્ટ સિંગલ ચેક (ઓનલાઇન મફત)	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫ પ્રતિ ચેક
સ્લોપ પેમેન્ટ સિરીઝ (ઓનલાઇન મફત)	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૨ ચેક સુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી

ટેકનિકલ ક્લરિફિકેશન/આઉટપુટ ચેક રિઝર્વના શુલ્ક	શૂલ્ક
સ્થાયી સૂચનાઓ સેટ અપ/સુધારણા (RD/SIP/ચિલ યુક્તવહીઓ માટે મફત)	પ્રતિ વખત રૂ. ૨૫
સ્થાયી સૂચનાઓ નિષ્કળતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦
નાણાકીય ક્લરિફિકેશન ECS/NACH રીઝર્વ	પ્રતિ રિઝર્વ રૂ. ૨૦૦
SMS ચેતવણીઓ (ક્રિડિટ અને ડેબિટ વ્યવહારો)	દર મહિને ૧૦ જમણ મફત. વ્યારબાદ, પ્રતિ જમણ ૩૦ પૈસા.
ફોન એક્સચેન્જ માર્ક-અપ ^૧	૩.૫%
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
શાખા ખાતે બેલેન્સ પ્રમાણપત્ર (ઓનલાઇન મફત)	પ્રતિ વખત રૂ. ૨૫૦/-
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજ સ્ટેટમેન્ટ (ઓનલાઇન મફત)	પ્રતિ વર્ષ ૧ મફત, વ્યારબાદ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦
પાસલુક જારી કરવી	શૂલ્ક
ડ્રુપિડેટ પાસલુક જારી કરવી	પ્રતિ વખત રૂ. ૫૦
સહીની ચકાસણી પ્રમાણપત્ર/ફોટો પ્રમાણિત/સન્માનની પુષ્ટિ	પ્રતિ વખત રૂ. ૫૦/-
ડ્રુપિડેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૦૦
ડ્રુપિડેટ એક્સચેન્જ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઈમેલ પર)	રૂ. ૫૦
DD/PO પુનઃમળની કરણ/રદી કરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની વિનંતી પર ખાતું બંધ	રૂ. ૫૦૦
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂલ્ક
ડેરેક્ટેપ બેંકિંગ^૨	
ચેક પિકઅપ (કોલ પર)	પ્રતિ વખત રૂ. ૫૦/-
કેશ પિકઅપ બીટ (દર મહિને)	રૂ. ૩૦૦
કેશ પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦	રૂ. ૫૦૦૦
રૂ. ૫૦૦૦૦૦ થી રૂ. ૧૦૦૦૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
કોલ પર કેશ પિકઅપ (દરેક વખતે શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૧૫૦
રૂ. ૨,૦૦,૦૦૦ થી રૂ. ૫,૦૦,૦૦૦	રૂ. ૩૦૦
રૂ. ૫,૦૦,૦૦૦ થી રૂ. ૨૦,૦૦,૦૦૦	રૂ. ૫૦૦
રૂ. ૨૦,૦૦,૦૦૦ થી રૂ. ૧૦,૦૦,૦૦૦	રૂ. ૮૦૦
૨૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
વ્યવહારોની સંખ્યા	
ગ્રાહક દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનું એકત્રીકરણ જેમાં શામેલ છે	
રોક/ચેક/DSB/DD (ઓનલાઇન અને એકીએક વડે શેલેલ વ્યવહાર સિવાય)	દર મહિને ૮ વ્યવહારો સુધી મફત
મુક્ત મર્યાદિથી વધુ પર શુલ્ક	વ્યક્તિગત વ્યવહાર શુલ્કની મર્યાદા ઉપરાંત પ્રતિ વ્યવહાર રૂ. ૧૫

^૧ વિનંતી પર ફક્ત પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ. લાનુ પડતા ક્લરિફિકેશન રહેશે કમલ- પેમેન્ટલ એટપાર ગમ: લાનુ પડતું નથી જમ: સેવિંગ્સ એક્સચેન્જ ઈમ: ક્રેડિટ એક્સચેન્જ

* નાણાકીય વ્યવહાર તરીકે ગણવામાં આવતા અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નિષ્કળ

* ELITE સેવિંગ્સ એક્સચેન્જ ELITE ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક હવે ELITE મોટામ સ્ટેટ્સ ધરાવતા નથી તો રૂ. ૬૦૦ શુલ્ક લાનુ પડે છે

^૨ ખારટાની ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્ડર પસંદ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ક્રીડેટ માર્ક-અપ ફી (લાનુ પડતા ક્લર) વસૂલવામાં આવશે. આ ઈમજમ ખાતા રેહળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાનુ પડે છે, સિવાય કે બીહાર્થિ (માસ્ટરકાર્ડ) અને ગયુજ (વિઝા પ્લેટિનમ). કુખ કરીને નોંધ લો કે બેંકની વિવેકવૃદ્ધિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.